

However, the contractor shall be responsible for normal maintenance of the work till the final bill for the work is prepared by the Departmental Officer.

Clause 17A Defect liability period : The contractor shall be responsible to make good and remedy at his own expense any defect which may develop or may be noticed before the period mentioned hereunder from the certified date of completion. The Engineer-in-charge shall give the contractor a notice in writing about the defects and the contractor shall make good the same within 15 days of receipt of the notice. In the case of failure on the part of the contractor, the Engineer-in-charge may rectify or remove or re-execute the work at the risk & cost of the contractor. The Engineer-in-charge shall be entitled to appropriate the whole or any part of the amount of security deposit towards the expenses, if any, incurred by him in rectification, removal or re-execution. The Defects Liability period for building works shall be as under(a) for all works costing upto Rs. 50,000 (amount put to tender), the period shall be 3 months from the certified date of completion.

(b) for all works costing more than Rs. 50,000 and upto Rs. 1 crore (amount put tender), the period shall be 12 months from the certified date of completion or one monsoon, whichever is later.

(c) for major projects costing more than Rs. 1 crore, (amount put to tender) the period shall be 36 months from the certified date of completion or three monsoons whichever is later..

For the purpose deciding monsoon period 30th september may be treated as the last date.

(Modified vide R. & BD Circular No. PAC-11-102008-2076-N 31-8-2009, PRCH-102013(2076) 2759-N Dated 27-5-2013 and Circular No. TNC /10/2016/Clause 17A (Correction/(1)C dated 12-5-2016.)

OR

CLAUSE 17A Defect liability period : (Applicable to Tenders for Work of Narmada, Water resources, Water Supply and Kalpsar department only).

A For Works other than Building

(A) For all Works costing up to Rs. 50,000 (Amount put to Tender) the period shall be Three Months.

(B.1) For works of Check Dams, Canals, Drainage and road structure estimated to cost more than Rs. 50,000 but up to Rs. 10.00 lacs the period shall be Six months.

(B.2) For works other than Check Dams, Canals, Drainage and road structure estimated to cost more than Rs. 50,000 but up to Rs. 10.00 lacs the period shall be Twelve months.

(C.1) For works of Check Dams, Canals, Drainage and road structure estimated to cost more than Rs. 10.00 lacs the period shall be Three years.

(C.2) For works other than Check Dams, Canals, Drainage and road structure estimated to cost more than up Rs. 10.00 lacs but upto Rs. One crore the period shall be Twelve months.

(D) All works estimated to cost more than Rs. One crore the period shall be Three years.

B. For Building Works : (i) For Building estimated to cost upto Rs. 50,000 the period shall be three months (ii) For Buildings works other than original building estimated to cost upto Rs. 50,000 but upto Rs. One crore the period shall be Twelve Months (iii) For original Building works the period shall be One years or elapse of one monsoon period which ever is later.

In above works the period shall be counted from the certified date of completion 30th September shall be treated as last date of monsoon (N.W.R. WS. & Kalpsar Department Order No. ૪૪૫/૧૦૨૦૧૩૦/૨/૨૦૧૩, ૧૮.૧૩-૧૨-૨૦૧૩)

Concrete Works : For works involving components of cement concrete estimate to cost more than Rs. 10 crores but upto Rs. 50 crores, the concrete Works shall be done by Concrete Batching Mixing Plant of minimum capacity of 15 C.M. /Hour or concrete Works shall be done by ready mix concrete. Further in respect of major projects of Dams, Barrages or Bridges estimated to cost above Rs. 50 crores, the concrete Works shall be done by Concrete Batching Mixing plant of minimum capacity of 100 C.M./Hour or concrete Works shall be done by ready mix concrete (N.W.R. WS. & Kalpsar Department Order No. ૨૬૫.૨૪૬.૨૬૫/૧૦૩૦૧૦/૧૦/૨) ૩. ૧૮.૨૬-૧૧-૨૦૧૩)

CLAUSE 17B Free maintenance guarantee period of three years for works of constructing B.T. surfaces.

(1) Contractor shall have to give three years free maintenance guarantee for period from the certified date of taking over. During this period contractor shall have to repair the damaged portion or the any portion of road and B.T. surface of road including pot holes, depressions, cuts or worn out portion at his risk and cost as per directions of Engineers. Five percent of value of B.T. items in each running bill shall be with held and released after this period is over. Provided for this amount the contractor shall be allowed to convert it in to F.D.R. or Bank Guarantee obtained in the name of Executive Engineer.

(2) Not Specified.

(3) Two percent of the amount eligible for payment bituminous items shall be withheld till the miscellaneous items like earthwork in embankment / cutting for side shoulders, side gutters, kilometre/indicator/guard stones, sign boards etc. are

Signature of the contractor :

કર્મચારીની સહી :

Signature of the Executive Engineer :

કાર્યપાલક ઇજનેરની સહી :

completed in all respect by the contractor. After completion of the miscellaneous items, the above said 2% withheld amount shall be released. (R&B Circular No. TNC-10-2013-3 (Part-III)-C, dated 13-12-2013)

CLAUSE 18 (1) For each work costing above Rs. One crore, the contractor shall have to engage minimum one graduate Engineer. He will be given Identity Card by the contractor. The copy of Identity Card shall be furnished for the Office of Deputy Executive Engineer, Executive Engineer and Superintending Engineer. The identified Engineer should remain present on the site of the work. The Contractor will have to produce the notarized Certificate periodically (At least in the beginning and in the month of completion of the work to the effect that the said designated graduate Engineer has not been appointed on any other work. If not found on site, the Engineer-in-charge will give notice of this default to the contractor. If in spite of this notice, default continues, the action to hold the registration of defaulter contractor in abeyance for three years will be initiated. (R. & B.D. Circular No. SSR-10-2008-18-C dated 13-10-08 and No. 424-102014-44 dated 4-11-2015)

(2) **Work to be open to inspections - Contractor or responsible agent to be present :-** All works under or in course of execution or executed in pursuance of the contract shall, at all times be open to the inspection and supervision of the Engineer-in-charge and his subordinates and the Contractor shall, at all times during the usual working hours, and all other times for which reasonable notice of the intimation of the Engineer-in-charge or his subordinate to visit the works shall have been given to the contractor, either himself be present to receive orders and instructions or have a responsible agent duly accredited in writing present for that purpose. Orders given to the contractor's duly authorised agent shall be considered to have the same force and effect as if they had been given to the Contractor himself.

CLAUSE 18A **Employment of a qualified site Engineer by the Contractor :** For works estimated to cost above Rs. 100 lacs. Within 15 days of issue of work-order the Contractor will have to furnish to the Deputy Executive Engineer-in-charge of the work the Name, Qualifications, Copy of marksheet, Colour Photograph and the appointment order issued to such Engineers engaged for this contract work. If 15 days after issue of work order such designated site Engineers do not resume or do not remain present on site of work, the recovery at the rate of Rs. 15,000-00 per month per Engineer will be made from the bills / deposit / dues of the contractor. Such recovery shall be non refundable.

The Engineer so employed for the Government work must have sufficient experience to handle the work independently. Such an Engineer shall have to stay at the site of work and he shall not be entrusted with other duty except this work. In case the contractor or partner of the contractor firm is a Civil Graduate Engineer, Employment of a separate Engineer will not be necessary provided that the Engineer partner himself attends the execution of the work on the site. (G.R.B. & CD No. RGN-602006-(35)-C, dated 31-5-07)

CLAUSE 19 **Notice to be given before work is covered up :** The contractor shall give not less than five day's notice in writing to the Engineer-in-charge or his subordinate in charge of the work before covering up or otherwise placing beyond the reach of measurement any work in order that the same may be measured and correct dimensions thereof taken before the same is so covered up or placed beyond the reach of measurement and if any work shall be covered up or placed beyond the reach of measurement without such notice having been given or consent obtained, the same shall be uncovered at the contractor's expense and in default thereof, no payment or allowance shall be made for such work or for the materials with which the same was executed.

CLAUSE 20 If the contractor or his workmen, or servants shall break, deface, injure or destroy any part of the building or the work in question in/on which they may be working or any building, road, fence, enclosure or grass-land or cultivated ground contiguous to the premises on which the works or any part thereof is being executed or if any damage shall be done to the work from any cause whatever before damage occurred/caused due to normal flood or rain or if any imperfections become apparent in it within three months from the grant of a certificate of completion, final or otherwise by the Engineer-in-charge, the contractor shall make good the same at own expenses or in default, the Engineer-in-charge may cause the same to be made good by other contractor, and deduct the expenses (of which the certificate of the Engineer-in-charge shall be final) from any sums that may thereafter become due to the contractor or from his security deposit or the proceeds of sale thereof or a sufficient portion thereof.

CLAUSE 20A Neither party shall be liable to the other for any loss or damage occasioned by or arising out of acts of God, such as Unprecedented flood, Volcanic eruption, earthquake or other convulsion of nature and other acts such as but not restricted to general strike, invasion, the acts of foreign countries, hostilities, or war like operations before or after declaration of war, rebellion, military or Usurped power which prevent performance of the contract and which could not have been foreseen or avoided by a prudent person.

Note : "Unprecedented flood" means the flood crossing the High Flood Level of the past _____ year(s) which is on the available record.

(Modified Vide R & B D. G. R. No. TNC - 1096 - IB - 143 - (16) - C dated 11-1-99)

CLAUSE 21 **Contractor to supply plant, ladders, scaffolding etc. and is liable for damage arising from non-provision of lights, fencing etc. :** The contractor shall supply at his own cost all materials (except such special materials if any, as may, in accordance with the contract to be supplied from the Public Works Department Stores), plant, tools, appliances, implements, ladders, cordage, tackle, scaffolding, and any temporary works which may be required for the proper execution of the work whether in the original, altered or substituted form and whether included in the specifications, or other documents forming part of the contract or referred to in these conditions or not and which may be necessary for the purpose of satisfying or complying with requirements of the Engineer-in-charge as to any matter or to which under

Signature of the contractor :

કર્મચારી સહી :

Signature of the Executive Engineer :

કાર્યપાલક ઉચ્ચેરની સહી :

these conditions he is entitled to be satisfied or which he is entitled to require together with carriage therefor to and from the work. The contractor shall also supply without charge the requisite number of persons with the means and materials necessary for the purpose of setting out works and counting, weighing and assisting in the measurement or examination at any time and from time to time, of the work or the materials, failing this, the same may be provided by the Engineer-in-charge at the expense of the Contractor and the expenses may be deducted from any money due to the Contractor under the contract or from his security deposit, or proceeds of sale thereof or of a sufficient portion thereof. The contractor shall provide all necessary fencing and lights required to protect the public from accident and shall also be bound to bear expenses of defence of every suit, action or other legal proceeding at law that may be brought by any person for injury sustained owing to neglect of the above precautions and to pay any damages and costs which may be awarded in any such suit, action or proceedings to any such person, or which may, with the consent of the Contractor, be paid in compromising any claim by any such person.

CLAUSE 21A The Contractor shall provide suitable scaffolds and working platforms, gangways and stairways, and shall comply with the following regulations in connection therewith.

ખંડ-૨૧ ક કંટ્રાક્ટરે યોગ્ય પાલખો અને કાચા માંચડા, જવા - આવવા માટેનાં પાટિયા અને સીડીની જોગવાઈ કરવાની રહેશે અને તે અંગે નીચે મુજબના નિયમોનું પાલન કરવાનું રહેશે.

- Suitable scaffolds shall be provided for workmen for all works that cannot be safely done from a ladder or by other means.
- સીડી ઉપરથી અથવા બીજા કોઈ સાફન દ્વારા સલામતિપૂર્વક ન કરી શકાય તેવા બંધાં કામ માટે કામદારો સારું યોગ્ય પાલખોની જોગવાઈ કરવાની રહેશે.
- A scaffold shall not be constructed, taken down or substantially altered except -
- અ) (૧) કાર્યક્ષમ અને જવાબદાર વ્યક્તિની દેખરેખ હેઠળ તે સિવાય,
- (૨) કંટ્રાક્ટર દ્વારા નિમાણેલ અને અનુભવ કરાવતા કાર્યક્ષમ કામદારો દ્વારા થતું હોય તે સિવાય, કોઈપણ પાલક બાંકવી નહીં, ઉતારવી નહીં કે તેમાં મહત્વના ફેરફાર કરવા નહિ.
- (c) All scaffolds and appliances connected therewith and all ladders shall -
- ગ) બકી પાલખો અને તેની સાથે સંકળાયેલ સામગ્રી અને બકી જ સીડીઓ -
- (i) be of sound material (૧) મજબૂત ચીજવસ્તુની બનેલી હોવી જોઈએ.
- (ii) be of adequate strength having regard to the loads and strains to which they will be subjected, and,
- (૨) તેના પરના આવનારા વજન અને ઘસારાને ખમી શકે તેટલી મજબૂત હોવી જોઈએ, અને
- (iii) be maintained in proper condition (૩) તેને સારી સ્થિતિમાં રાખવાની રહેશે.
- (d) Scaffolds shall be so constructed that no part thereof can be displaced in consequence of normal use.
- ધ) પાલખો એવી બાંકવાની રહેશે કે સામાન્ય વપરાશથી તેનો કોઈ પણ ભાગ છૂટો પડી ન જાય.
- (e) Scaffolds shall not be overloaded and so far as practicable the load shall be evenly distributed.
- ચ) પાલખો પર વકારે પડતું વજન મૂકવું નહિ અને શક્ય હોય ત્યાં સુધી તે વજન સમગ્ર પાલખ પર એકસરખું વહેંચી નાંખવું.
- (f) Before installing the lifting gear on scaffolds, special precaution shall be taken to ensure the strength and stability of the scaffolds.
- છ) પાલખો પર માલ ઉચકવા માટેના ગિયર ગોઠવતાં પહેલાં પાલખોની મજબૂતાઈ અને ટકાઉપણાની ખાતરી કરવાની ખાસ સાવચેતી લેવી.
- (g) Scaffolds shall be periodically inspected by a competent person.
- જ) કાર્યક્ષમ વ્યક્તિ દ્વારા વખતોવખત પાલખોની તપાસ કરવાની રહેશે.
- (h) Before allowing a scaffold to be used by his workmen, the Contractor shall, whether the scaffold has been erected by his workmen or not, take steps to ensure that it complies fully with the regulation herein specified.
- ઝ) તેના કામદારોએ પાલખો બાંકી હોય કે ન હોય તો પણ પોતાના કામદારોને તે પાલખનો ઉપયોગ કરવા દેતાં પહેલાં કંટ્રાક્ટરે તેવી પાલખો અહીં જણાવેલ વિનિયમો અનુસાર બરાબર હોવા બાબતની ખાતરી કરવાની રહેશે.
- (i) Working platforms, gangways shall-
- (i) be so constructed that no part thereof can sag unduly or unequally.
- (૨) કાચા માંચડાં જવા - આવવા માટેના પાટિયા અને સીડીઓ બાં તી વખતે નીચેની બાબતો ખ્યાલમાં રાખવાની રહેશે.
- (૧) તેનો કોઈ પણ ભાગ વધુ પડતો કે અસમાન રીતે ઝૂકી ન જવો જોઈએ.
- (ii) be so constructed and maintained having regard to the prevailing conditions as to reduce as far as practicable risks of persons tripping or slipping and -
- (૨) માણસો ગબડી કે લપસી પડે તેવું જોખમ બને તેટલું ઓછું રાખવા માટે પ્રવર્તતા સંજોગો અનુસાર તે બાંકવા અને જાળવવા, અને
- (iii) be kept free from any unnecessary obstruction.

Signature of the contractor :

કંટ્રાક્ટરની સહી :

Signature of the Executive Engineer :

કાર્યપાલક ઈજનેરની સહી :

GBS

(૩) કોઈ પણ જાતના બિનજરૂરી અવરોધથી મુક્ત રાખવા.

(j) In the case of working platforms, gangways working places and stairways at a height exceeding 2.00 metre (to be specified) (જણાવવી)

(ક) ૨.૦૦ મીટરથી વધુ ઉંચાઈવાળા કાચા માંચડા, જવા - આવવા માટે પાટિયા કામની જગ્યા અને સીડીઓની નીચે મુજબની જોગવાઈ રહેશે.
(i) every working platform and every gangway shall be closely boarded unless other adequate measures are taken to ensure safety.(૧) સલામતીના બીજા પૂરતાં પગલાં ન લેવાયાં હોય તો દરેક કાચો માંચડો અને જવા આવવા માટેનું દરેક પાટિયું લગભગ જોડેલું હોવું જોઈએ.
(ii) every working platform and every gangway shall have adequate width, and

(૨) દરેક કાચા માંચડા અને જવા - આવવા માટેના પાટિયાં, પૂરતી પહોળાઈવાળા હોવા જોઈશે, અને

(iii) every working platform, gangway, working place and stairway shall be suitably fenced

(૩) દરેક કાચા માંચડા અને જવા - આવવા માટેના પાટિયાં કામની જગ્યા અને સીડીઓને યોગ્ય કહેરા હોવા જોઈશે.

(k) Every opening in the floor of a building or in a working platform shall, except for the time and to the extent required to allow the access of person or the transport or shifting of materials be provided with suitable means to prevent the fall of persons or material.

(૪) માણસો આવી જઈ શકે અથવા માલસામાનની ઠેરઠેર થઈ શકે કે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ સલામત તેટલા વખત અને તેટલા પૂરતી મકાનની ઠરસ કે કાચા માંચડા પરની પ્રત્યેક ખુલ્લી જગ્યા પર એવા યોગ્ય સાધનો મૂકી રાખવા કે જેથી કોઈ માણસ કે માલસામાન પડી ન જાય.

(l) When persons are employed on a roof where there is danger of falling from a height exceeding 3.00 (to be specified) meters suitable precaution shall be taken to prevent the fall of persons or material.

(૬) જ્યાંથી પડી જવાનો ભય હોય તેવી ૩.૦૦ (જણાવવી) મીટરથી વધુ ઉંચાઈના છાપરા પર માણસોને કામે રાખવામાં આવ્યા હોય ત્યાંથી માણસો કે માલસામાન પડી ન જાય તે માટે સાવચેતીના યોગ્ય પગલાં લેવાનાં રહેશે.

(m) Suitable precautions shall be taken to prevent persons being struck by articles which might fall from scaffold or other working places.

(ત) પાલખો કે કામકાજની બીજી જગ્યાઓ પરથી પડે તેવી ચીજવસ્તુઓથી માણસને ઈજા ન થાય તે માટે સાવચેતીનાં યોગ્ય પગલાં લેવા.

(n) Safe means of access shall be provided to all working platforms and other working places.

(ખ) બધા કાચા માંચડા અને કામની બીજી જગ્યાઓએ સહેલાઈથી જવા માટે સલામત માર્ગોની જોગવાઈ કરવાની રહેશે.

CLAUSE 21B The contractor shall comply with the following regulations as regards the hoisting appliances to be used by him-

(ખડ-૨૧-બ) કંટ્રાક્ટર વજન ઉચ્કવાના સાધનો વાપરે તે સંબંધિત તેણે નીચેના વિનિયમોનું પાલન કરવાનું રહેશે.

(a) Hoisting machines and tackle including their attachments, anchorages and supports shall -

(ક) વજન ઉચ્કવાનાં યંત્રો અને ગરગડીવાળા યંત્ર, તેમની સાથેના જોડાણો, લંગર માટેના સામાન અને ટેકા નીચે મુજબના હોવા જોઈશે :-

(i) be of good mechanical construction, sound material and adequate strength and free from patent defect, and

(૧) સારી યંત્રિક રચનાવાળાં, મજબૂત વસ્તુના તેમજ પૂરતી તાકાતવાળા અને દેખીતી કોઈ ખામી વિનાના ત અને

(ii) be kept in good repair and in working order. (૨) સારી દુરસ્ત હાલતમાં અને ચાલુ સ્થિતિમાં રાખવા જોઈશે.

(b) every rope used in hoisting or lowering materials or as a means of suspension shall be of suitable quality and adequate strength and free from patent defect.

(ખ) માલસામાનને ઉંચે ચડાવવા કે નીચે ઉતારવા અથવા લટકતો રાખવાના સાધન તરીકે વપરાતું દોરડું યોગ્ય જાતનું અને પૂરતી મજબૂતાઈવાળું તેમજ દેખીતી ખામી વિનાનું હોવું જોઈએ.

(c) Hoisting machines and tackles shall be examined and adequately tested after erection on the site and before use and be re-examined in position at intervals to be prescribed by Engineer-in-charge.

(ગ) વજન ઉચ્કવાનાં યંત્રો અને ગરગડીવાળાં યંત્રને કામના સ્થળે ચોક્કસ બાદ અને ઉપયોગમાં લીધા પહેલાં તપાસી જોઈને પૂરતા પ્રમાણમાં ચકાસી લેવાના રહેશે, તેમજ હવાલાના ઈજનેર નિયત કરે તેવા સમયાંતરે, ચોક્કસ સ્થિતિમાં તેની ઠેર તપાસ કરવાની રહેશે.

(d) Every chain, ring, hook, shackle, swivel and pulley block used in hoisting or lowering materials or as a means of suspension shall be periodically examined.

(ઘ) માલસામાન ઉંચે ચડાવવાના કે નીચે ઉતારવા કે લટકતો રાખવાના સાધન તરીકે વપરાતા પ્રત્યેક સાંકળ, રીંગ, આંકડો કડી, નકુચા અને પુલીબ્લોક વખતોવખત તપાસવા.

(e) Every crane driver or hoisting - appliance operator shall be properly qualified.

(ચ) પ્રત્યેક કેઈન- ડ્રાઈવર કે વજન ઉચ્કવાના યંત્રના ચાલક યોગ્ય લાયકાતવાળા હોવા જોઈશે.

Signature of the contractor :

કંટ્રાક્ટરની સહી :

Signature of the Executive Engineer :

કાર્યપાલક ઈજનેરની સહી :



- (f) No person who is below age of 15 years shall be in control of any hoisting machine, including any scaffolds, nor shall give signals to the operator.
- (g) ૧૫ વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિને કોઈ પાલખ સહિત વજન ઉઠાવવા કોઈ યંત્રના નિયંત્રક તરીકે અથવા ઓપરેટરને નિશાનીથી ચૂંચના આપવા, કામે રાખી શકાશે નહીં.
- (g) In the case of every hoisting machine and of every chain, ring hook, shackle, swivel and pulley block used in hoisting or lowering or as a means of suspension the safe working load shall be ascertained by adequate means.
- (જ) વજન ઉઠાવવાના પ્રત્યેક યંત્ર અને માલસામાન ઉંચે ચડાવવાના કે નીચે ઉતારવાના કે લટકાવી રાખવાના સાફન તરીકે વપરાતી પ્રત્યેક સાંકળ, રીંગ, કડી, નકુચા અને પુલી - બ્લોકની સલામત રીતે વજન ઉઠાવવાની શક્તિ કેટલી છે તે યોગ્ય સાફનો વડે નક્કી કરવાનું રહેશે.
- (h) Every hoisting machine and all gears referred to in preceding regulation shall be plainly marked with the safe working load.
- (ઝ) આગળના વિનિયમમાં જણાવેલ વજન ઉઠાવવાના પ્રત્યેક યંત્ર અને બકા જ ગિયર પર તે સલામત રીતે કેટલું વજન ઉઠાવી શકે તેમ છે. તે ચ. ૩ લખેલું હોવું જોઈએ.
- (i) In the case of hoisting machine having a variable safe working load, each safe working load and conditions under which it is applicable shall be clearly indicated.
- (ટ) જુદાં જુદાં વજન સલામત રીતે ઉઠાવી શકતા, ઉઠાવવાના યંત્ર પર, સલામત રીતે ઉઠાવી શકાતું પ્રત્યેક વજન અને કઈ હાલતમાં યંત્રને તે લાગુ પડશે તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
- (j) No part of any hoisting machine or gear referred to in regulation 'g' above shall be loaded beyond the safe working load except for the purpose of testing.
- (ઠ) ઉપરના વિનિયમ જેમાં જણાવેલ વજન ઉઠાવવાના કોઈ પણ યંત્ર કે ગિયરના કોઈ પણ ભાગ પર ચકાસણી માટે જરૂરી હોય તે સિવાય, સલામત વજન કરતાં વધુ વજન લાદવું નહિ.
- (k) Motors, gears, transmissions, electric wiring and other dangerous parts of hoisting appliances shall be provided with sufficient safeguards.
- (ડ) વજન ઉઠાવવાના સાફનની મોટરો, ગિયર, વિદ્યુતવાહક સાફનો, વીજળીના તાર અને જોખમી ભાગો માટે પૂરી સલામતીની જોગવાઈ કરવાની રહેશે.
- (l) Hoisting appliances shall be provided with such means as will reduce to a minimum the risk of the accidental descent of the load.
- (ઢ) કોઈ વજન અકસ્માત નીચે સરકી પડે તેવું જોખમ ઓછામાં ઓછું રહે તે પ્રકારની કોઈક સગવડ વજન ઉઠાવવાના સાફનમાં કરવાની રહેશે.
- (m) Adequate precautions shall be taken to reduce to minimum the risk of any part of a suspended load becoming accidentally displaced.
- (ત) લટકતા રાખેલા વજનમાંથી કોઈપણ ભાગ અકસ્માત છુટી પડી જવાનું જોખમ ઓછામાં ઓછું રહે તે માટે પુરતી સાવચેતી રાખવાની રહેશે.

CLAUSE 22 Measures for Prevention of Fire : The contractor shall not set fire to any standing jungle, trees, bush wood or grass without a written permit from the Engineer-in-charge.

When such permit is given, and also in all cases when destroying cut or dug up tress, bush wood, grass etc. by fire, the contractor shall take necessary measures to prevent such fire spreading to or other-wise damaging surrounding property.

When such permit is given, and also in all cases when destroying cut or dug up tress, bush wood, grass etc. by fire, the contractor shall take necessary measures to prevent such fire spreading to or other-wise damaging surrounding property.

CLAUSE 23 Liability of contractors for any damages done in or outside work area : Compensation for all damage done intentionally or unintentionally by Contractor's labourers whether in or beyond limits of Government property including any damage caused by the spreading of fire mentioned in the clause 22, shall be estimated by the Engineer-in-charge, or any other Officer as he may appoint and the estimates of the Engineer-in-charge, subject to the decision of the Superintending Engineer, on appeal, shall be final and the contractor shall be bound to pay the amount of the assessed compensation on demand, failing which the same will be recovered from the Contractor as damages in the manner prescribed in clause 1 or deducted by the Engineer-in-charge from any sums that may be due or become due from Government to the contractor under this contract or otherwise.

ખંડ-૨૩ કામના વિસ્તાર અથવા તેના બહાર થયેલ કોઈ પણ નુકશાન માટે કોન્ટ્રાક્ટર જવાબદાર હોવા બાબત : ખંડ-૨૨માં જણાવ્યા પ્રમાણે આગ પ્રસરવાથી થયેલ કોઈપણ નુકશાન સહિત કંટ્રાક્ટરના મજૂરોએ ઉપદ્રાપૂર્વક કે અજાણતાં સરકારી મિલકતની હદની અંદર કે બહાર કરેલાં બકા જ નુકશાનના વખતરનો અંદાજ હવાલાના ઇંજનેર અથવા એમણે નીમેલા બીજા કોઈ અધિકારી કાદરો અને હવાલાના ઇંજનેરનો આ અંદાજ, અપીલ થયે, અધિકાર ઇંજનેરના નુકસાનને આધારિત, આખરી ગણાશે અને માગણી કરતાં આકારાથેલી વખતરની તેવી રકમ ચૂકવવા માટે કંટ્રાક્ટર બંધાયેલ રહેશે અને તેમ કરવામાં કસૂર કરશે તો તેવી રકમ ખંડ-૧માં ઠરાવેલી રીતે નુકશાનની તરીકે કંટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે અથવા આ કંટ્રાક્ટ હેઠળ અન્યથા સરકાર

Signature of the contractor :
કંટ્રાક્ટરની સહી :

Signature of the Executive Engineer :
કાર્યપાલક ઇંજનેરની સહી :

પાસે લેણી પત્તી કે હવે પછી લેણી ગાય તેવી રકમમાંથી હવાલાના ઈજનેર કાપી લેશે.

The Contractor shall bear the expenses of defending any action or other legal proceeding that may be brought by any person for injury sustained by him owing to neglect of precautions to prevent the spread of the fire and he shall also pay the damages and cost that may be awarded by the court in consequence.

આગ પ્રસરતી અટકાવવા સારું સાવચેતીના પગલાં લેવામાં પામેલી વેદરકારીને પરિણામે કોઈ વ્યક્તિને મળેલ ઈજા માટે કોઈ પગલાં લે કે બીજા કાનૂની કાર્યવાહી કરે તો તેની સામેના અચાવનું ખર્ચ કંટ્રાક્ટરે ભોગવવાનું રહેશે અને તેવી કાર્યવાહીને પરિણામે કોર્ટ તરફથી ચૂકાદો આપતાં તે નુકસાની અને ખર્ચ ભરવાનું ઘાય તે તેમણે ચૂકવવાનું રહેશે.

ખંડ ૨૭ ક્વિટા સ્લોડ કચોડથી થતુ રકમના ઘાટગોળા અને રૂઝદારીગના કામોમાં દરેક સ્તરનું ટોમ્પેડરાન વ્યવસ્થિત રીતે ઘાય તે માટે તીવ્રતી કાર્યવાહી અનુસરવાની રહેશે :

૨૪.૧ રસ્તાની કરવાની પરીણાઈમાં પાસાપોરણ મુજબ કોમ્પેક્શન ઘાય તે માટે બેબી સોલર ફરજિયાત રીતે લાવી કોમ્પેક્શન કરવાનું રહેશે.

૨૪.૨ અથવા કામોમાં દરેક સ્તરનું કોમ્પેક્શન પાસાપોરણ મુજબ થવું છે, તેની દરેક વીયરે ફરજિયાતપણે ડેન્ડીટો મીટરથી ક્રીડ પ્રમાણે થવાની ચકાસણી ઈજનેરદારે કરી તેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આવી ચકાસણી સંબંધિત નામના કાર્યપાલક ઈજનેરથી, અને મદદનીશ / અધિક મદદનીશ ઈજનેરથીએ પણ કરવાની રહેશે. ઈજનેરદારે કરેલ કામની ડેન્ડીટી પુરેપુરી મળ્યા બાદ જ કલીયરન્સ અપાય અને ત્યારબાદ જ બીજા વેયરની કામગીરી હાથ ધરાય તે જોવાનું રહેશે. (મા.મ.વિ. પરિપત્ર નં. એસ.એસ.આર.-૧૦-૨૦૦૮-૧૮-સી, તા. ૧૩-૧૦-૦૮ તથા મા.મ.વિ. પરિપત્ર નં. એસ.એસ.આર.-૧૦-૨૦૧૭-૫૦-સી, તા. ૨૯-૮-૨૦૧૭ તથા તા. ૧૧-૯-૨૦૧૭)

CLAUSE 25 Deleted.

CLAUSE 26 Work not to be sublet. Contract may be rescinded and security deposit forfeited for subletting it without approval or for bribing a public officer or if contractor becomes insolvent : The contract shall not be assigned or sublet without the written approval of the Engineer-in-charge. And if the contractor shall assign or sublet his contract or attempt to do so or become insolvent or commence any proceeding to get himself be adjudicated an insolvent or make any compromise with his creditors, or attempt to do so, the Engineer-in-charge may, by notice in writing rescind the contract. Also if any bribe, gratuity, gift, loan, perquisite, reward or advantage, pecuniary or otherwise, shall either directly or indirectly be given, promised or offered by the contractor, or any of his servants or agents to any public officer or person in the employ of Government in any way relating to his office or employment, or if any such officer or person shall become in any way directly or indirectly interested in contract, the Engineer-in-charge may thereupon by notice in writing rescind the contract. In the event of contract being rescinded, the security deposit of the contractor shall thereupon stand forfeited and be absolutely at the disposal of Government and the same consequence shall ensure as if the contract had been rescinded under clause 3 hereof and in addition the contractor shall not be entitled to recover or be paid for any work therefor actually performed under the contract.

ખંડ-૨૬ અધિકાર પેટા ભાડે ન આપવા બાબત. મંજૂરી વિના પેટાભાડે આપવાથી અથવા સરકારી અધિકારીને લાંચ આપવા માટે અથવા કંટ્રાક્ટર નાદાર મળેથી કંટ્રાક્ટ રદ થાય અને જામીન અનામત જપ્ત થવા બાબત : હવાલાના ઈજનેરના ચિખિત પરવાનગી સિવાય કંટ્રાક્ટ કોઈને એસાઈન કરી શકારો કે પેટાભાડે આપી શકારો નહિ, અને કંટ્રાક્ટર તેમની કંટ્રાક્ટર એસાઈન કરશે અથવા પેટાભાડે આપશે કે તેમ કરવાનો પ્રયત્ન કરશે કે નાદાર બનશે કે પોતાને નાદાર કરાવવા માટેની કોઈ કાર્યવાહી કરશે કે પોતાના વેલ્દારો સાથે કોઈ પતાવટ કરશે કે તેમ કરવાનો પ્રયત્ન કરશે તો હવાલાના ઈજનેર ચિખિત નોટીસ આપીને કંટ્રાક્ટ રદ કરી શકશે. વળી કંટ્રાક્ટર કે તેમના કોઈ નોકર કે એજન્ટ કોઈ સરકારી અધિકારીને અથવા સરકારી નોકરીમાં ના કોઈ પણ વ્યક્તિને તેના હોત કે નોકરીની રૂએ કોઈપણ પ્રકારની લાંચ, ભક્ષિસ, ભેટ, અનુલાન, ઉનામ કે આર્થિક બીજા કોઈ પ્રકારના લાભ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપશે, આપવાનું વચન આપશે કે આપવાની તૈયારી બતાવશે અથવા આવા કોઈ અધિકારી કે વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંટ્રાક્ટમાં સિત કરાવતા થશે તો હવાલાના ઈજનેર ચિખિત નોટીસ આપીને કંટ્રાક્ટ રદ કરી શકશે. આવી રીતે કંટ્રાક્ટ રદ થતાં કંટ્રાક્ટરની જામીન અનામત જપ્ત થયેલ ગણાશે, અને તે સંપૂર્ણપણે સરકાર હસ્તક રહેશે અને આ કરારના ખંડ-૩ હેઠળ જાણે કે કંટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હોય તેવા જ તેના પરિણામો આવશે અને વધુમાં કંટ્રાક્ટ હેઠળ ખરેખર કરેલા કોઈ પણ કામ માટે કોઈ રકમ વસૂલ કરવાને કે ચૂકવે લેવાનો કંટ્રાક્ટરને હક્ક રહેશે નહિ.

CLAUSE 27 Sums payable by way of compensation to be considered as reasonable compensation without reference to actual loss : All sums payable by a contractor by way of compensation under any of these conditions shall be considered as a reasonable compensation to be applied to the use of Government without reference to the actual loss or damage sustained and whether any damage has or had not been sustained.

ખંડ-૨૭ ખરેખર મળેલ ખોટને લક્ષમાં લીધા સિવાય વળતરરૂપે ચૂકવવાની પત્તી રકમને વાજબી વળતર ગણવા બાબત : ખરેખર ખોટ કે નુકસાનને લક્ષમાં લીધા સિવાય અને કોઈ નુકસાન થયું હોય કે ન થયું હોય તો પણ આ સરતોમાંની કોઈપણ સરત હેઠળ કંટ્રાક્ટરે વળતરરૂપે ચૂકવવાની પત્તી તમામ રકમને વાજબી વળતર ગણવામાં આવશે અને તેને સરકાર માટે ઉપયોગમાં લેવાશે.

CLAUSE 28 Change in the constitution of firm to be notified : In the case of a tender by partners, any change in the constitution of a firm shall be forthwith notified by the Contractor to Engineer-in-charge for his information.

ખંડ-૨૮ પેટીના બંધારણમાં કોઈ ફેરફાર થયે તેની જાણ કરવા બાબત : ભાગીદારોએ ટેન્ડર ભર્યું હોય તે કેસમાં પેટીના બંધારણમાં કોઈ ફેરફાર થતાં કંટ્રાક્ટરે હવાલાના ઈજનેરને તેમની જાણ અર્થે તેવા ફેરફાર અંગે તરત જાણિતગાર કરવાના રહેશે.

CLAUSE 29 Works to be under directions of Superintending Engineer : All works to be executed under the contract shall be executed under the direction and subject to the approval in all respects of Superintending Engineer of the Circle for the time being, who shall be entitled to direct at what point or points and in what manner they are to be commenced and from time to time carried on.

Signature of the contractor :

કંટ્રાક્ટરની સહી :

Signature of the Executive Engineer :

કાર્યપાલક ઈજનેરની સહી :

ખંડ-૨૯ અધિકાર ઉજારની સૂચના હેઠળ કામો કરવા બાબત : કંટ્રાક્ટ હેઠળ કરવાના બધા જ કામ સર્કલના જે તે વખતના અધિકાર ઉજારની સૂચના અને હેઠળ તમામ બાબતો માટે તેમની મંજૂરીને આધીન રહીને કરવાના રહેશે. આ કામ ક્યા સ્થળે કે સ્થળોએ અને કેવી રીતે શરૂ કરવા બાબતો વનન કેવી રીતે આગળ ધપાવવા તે અંગે સૂચના આપવા અધિકાર ઉજાર હકકદાર રહેશે.

CLAUSE 30 (1) Disputes to be referred to Tribunal : The disputes relating to this contract, so far as they relate to any of the following matters, Whether such disputes arise during the progress of the work or after the completion or abandonment thereof, shall be referred to the Arbitration Tribunal, Gujarat State.

(i) The rates of payment under clause 5 for any tools, materials and stores, in or upon the works of the site thereof or belonging to the contractor or procured by him and intended to be used for execution of the work or any part thereof or possession of which may have been taken by the Engineer-in-charge under the said clause - 5.

(ii) The reduction in rates made by the Engineer-in-charge under clause 9 from the items of works not accepted as complete fully in accordance with the sanctioned specifications.

(iii) The rate of payment for any class of work which is included in the additional or altered work carried out by the contractor in accordance with the instructions of the Engineer-in-charge under clause 14 and the rates for which is to be determined under the said clause 14.

(iv) The rates of payment for materials already purchased or agreed to be purchased by the contractor before receipt of notice given by the Engineer-in-charge under clause 15, and/or the amount of compensation payable to the contractor under the said clause for loss in respect of such materials.

(v) The amount of compensation which the contractor shall be liable to pay under clause 17 in the event of his failure to rectify, remove or reconstruct the work within the period specified in the written intimation or the amount of expenses incurred by the Engineer-in-charge under the said clause 17 in rectifying, removing or re-executing the work or in moving and replacing the materials or articles complained of.

(vi) The reduction of rates as may be fixed by the Engineer-in-charge under clause 17 for the inferior work or materials as accepted or made use of.

(vii) The amount of compensation payable by the contractor for damages as estimated and assessed under clause 23.

(viii) The amount payable to the contractor for the work carried out under clause 33 in accordance with the instructions and the requirements of the Engineer-in-charge in a case where there are no specifications.

(2) The provision of Section-21 of the GPW dispute Arbi. Tribunal Act-92 & order issued by the Govt. in connection with this Act will now apply for Arbitration (As per Government N. & W.R.D. letter No. SUT/1090/2679/K2 dtd. 9/2/94).

(3) The provision of Arbitration Act., shall in so far as they are inconsistent with the provision of this act, cease to apply to any dispute arising from a works contract and all arbitration proceedings in relation to such dispute before an arbitrator, court of authority shall stand transferred to the Tribunal.

(4) The awards declared by the arbitrator should be speaking award, giving reasons and calculations for every item of claims. The decision will have to be implemented by all the departments of the State Government and Public Sector Enterprises of Gujarat. (Resolution F.D.No. PB/1088/735/KT/Sachivalaya/Gandhinagar 5th October 1988.)

(5) In case of dispute leading to the contractor or Government of Gujarat approaching to Court of Law, It shall be within the jurisdiction where the site of work is situated.

(6) The reference to arbitration proceeding under this clause shall not :

(i) affect the right of the Engineer-in-charge under clause 5 to take possession of all or any tools, plants, materials and stores in or upon the works of site thereof belonging to the contractor or procured by him and intended to be used for the execution of the work or any part thereof.

(ii) Preclude the Engineer-in-charge from utilising the materials purchased by the contractor in any work or from removing such materials to other places, during the period the work is stopped or suspended in pursuance of notice given to the contractor under clause 15.

(iii) Entitle the contractor to stop the progress of the work or the carrying out the additional or altered work in accordance with the provisions of clause 14 or as the case may be, of clause 33.

CLAUSE 31 Deleted.

CLAUSE 32 Lump sum in estimates : When the estimate on which a tender is made includes lump sum in respect of part of the work, the contractor shall be entitled to payment in respect of the items of work involved or the part of the work in question at the same rates as are payable under this contract for such items, or if the part of the work in question is not in the opinion of the Engineer-in-charge capable of measurement, the Engineer-in-charge may, as his discretion, pay the

Signature of the contractor :

કંટ્રાક્ટરની સહી :

Signature of the Executive Engineer :

કાર્યપાલક ઉજારની સહી :

lump sum amount entered in the estimate and the certificate in writing of the Engineer-in-charge shall be final and conclusive against the contractor with regard to any sum or sums payable to him, under the provisions of this clause.

ખંડ-૩૨ **અંદાજના ઉચ્ચ રકમો :** જે અંદાજના આધારે ટેન્ડર તૈયાર કરવું હોય તેમાં જો કામના અગ્રુક ભાગો અંગે ઉચ્ચ રકમનો સમાવેશ થતો હોય તો આવી બાબતો માટે આ કંટ્રાક્ટ હેઠળ ચૂકવવાપાત્ર હોય તે જ હરે, જ્યેલ કામની બાબતો માટે ઉક્ત કામના કોઈ ભાગ માટે ચૂકવણી મેળવવા કંટ્રાક્ટર હક્કદાર રહેશે, અથવા હવાલાના ઈજનેરના મતે ઉક્ત કામના તે ભાગનું માપ લઈ સકાય તેમ ન હોય, તો હવાલાના ઈજનેર પોતાના સ્વવિવેક અનુસાર અંદાજમાં નોંધાયેલી ઉચ્ચ રકમ ચૂકવી શકશે અને આ ખંડની જોગવાઈ હેઠળ કંટ્રાક્ટરને ચૂકવવાપાત્ર થતી રકમ કે રકમોને લગતું હવાલાના ઈજનેરનું લિખિત પ્રમાણપત્ર તેના માટે આપરી અને નિર્ણાયક લેખાશે.

CLAUSE 33 Action where no specifications : In the case of work for which there is no such specification, such work shall be carried out in accordance with the Divisional Specification and in the event of there being no Divisional Specifications, then, in such case the work shall be carried out in all respects in accordance with the instructions and requirements of the Engineer-in-charge.

ખંડ-૩૩ **કોઈ વિગતો ન જાણી હોય ત્યારે લેવાના પગલાં :** કોઈ વિગતો ન હોય તેવા પ્રકારના કામની બાબતમાં તેવું કામ ડિવિઝનની વિગતો અનુસાર હાથ કરવાનું રહેશે અને ડિવિઝનની વિગતો ન હોય ત્યારે તેવું કામ તમામ રીતે હવાલાના ઈજનેરની સૂચનાઓ અને જરૂરિયાત અનુસાર હાથ કરવાનું રહેશે.

CLAUSE 34 Definition of work : The expression "work" or "works" where used in these conditions shall, unless, there be something in the subject or context repugnant to such construction be construed to mean the work, or the works, contracted to be executed under or in virtue of the contract, whether temporary or permanent and whether original, altered, substituted or additional.

ખંડ-૩૪ **કામની વ્યાખ્યા :** આ શરતોમાં વપરાયેલ કામ અથવા કાર્યક્રમો વિષયના સંદર્ભમાં કશું વિરુદ્ધ ન હોય તો કામચલાઉ કે કાયમી અને મૂળ સંધારણા, બદલવામાં આવેલા કે વધારાના કંટ્રાક્ટ હેઠળ કે કંટ્રાક્ટરની રૂએ કરવાના થતી કામ કે કામો એવો ધરો.

CLAUSE 35 Contractor's percentage whether applied to net or gross amount of the bill : Percentage referred to in the tender shall be deducted from / added to the gross amount of the bill before deducting the value of any stock issued. (This clause shall be Applicable only for B-1 tender)

ખંડ-૩૫ **કંટ્રાક્ટરની ઠરાવારી જિલ્લા સોજીની કે એકંદરે રકમને લાગુ પાડવી :** આપવામાં આવેલ કોઈ પણ માલસામાનની કિંમત બાદ કરતાં પહેલાં ટેન્ડરમાં દર્શાવેલ ટકાવારી જિલ્લાની એકંદર રકમમાંથી બાદ કરવામાં આવશે - તેમાં ઉમેરવામાં આવશે. (આ ખંડ બી-૧ ટેન્ડરને જ લાગુ પડશે)

CLAUSE 35 (i) On receipt of the work order, the contractor will identify the sources of procurement of quarried construction materials like metal, kapchi, grit, sand etc. and seek the permission of the Engineer-in-Charge about the sources. The Engineer-in-Charge will issue orders approving the sources of procurement of quarried construction materials. The contractor will thereafter procure the materials from approved sources for use in the contract work. The Dy. Executive Engineer will verify this with reference to the copies of gate passes before recording the measurements of such materials.

(ii) Non refund of quarry fees & Royalties : The contractor shall pay the royalty to the competent authority/ local body as per rules. The contractor shall furnish quarterly the statement showing quantity of quarried materials, from whom purchased (with full address of the seller) and copies of bills for purchase to the District Officer of the Mining and Geology Department or authority competent to levy royalty in the area of work. Contractor shall also furnish such additional information as regards royalty payment to the Royalty authority. The royalty charges paid shall be borne by the Contractor and shall not be reimbursed by the Executive Engineer (Authority :- R & BD Circular No. TNC-2286 -UO -39 (19) - C, dated 23-10-1989.)

(૩) કાર્યપાલક ઈજનેરશ્રી કામનો વર્ક ઓર્ડર આપે કે તુરંત જ કામના શીડ્યુલ - બીની નકલ જે તે વિસ્તારના મદદનીશ નિયામક અથવા જીઓલોજીસ્ટ અથવા આસીસ્ટન્ટ જીઓલોજીસ્ટ અથવા ભુસ્તર અને ખનીજ શાખાના જલ્લા કચેરીના વડા જેઓ કલેક્ટરશ્રીની કચેરીમાં બેસે છે તેમને આપવાની રહેશે. (૨) રૂ. ૨.૦૦ લાખ (બે લાખ)થી ઉપરના કામોના કોન્ટ્રાક્ટરોએ તેઓએ ખરીદેલ ખનીજનો જથ્થો અને તે ક્યાંથી ખરીદેલ છે તે વેચનારની વિગતો દર્શાવતાં બીલોની નકલો તથા પગકના રૂપમાં માહિતી દર ત્રણ માસે ઉપર (૧)માં દર્શાવેલ અધિકારીને પુરી પાડવાની રહેશે. આ બીલોમાં માલ વેચનારનું નામ, સ્થળ, તારીખ અને માલ લેનારનું નામ, માલ લેનારનું નામ અને જથ્થો, વગેરે દર્શાવેલા હોવા જોઈએ (૩) જરૂર પડ્યે જરૂરી કિસ્સામાં ઉપર (૧)માં દર્શાવેલ અધિકારીશ્રી તરફથી વધુ માહિતી-વિગત માલ કે બીલનાં સંબંધમાં માંગવામાં આવે તો તે જે તે કાર્યપાલક ઈજનેરશ્રી ખનીજ ખાતાના અધિકારીને તે વિગતો કોન્ટ્રાક્ટર પાસેથી મેળવવામાં મદદ કરશે. જો આવી માહિતી સમયસર આપવામાં ન આવે તો કોઈ કાર્યપાલક ઈજનેરશ્રી, તરફથી આ અંગે સહકાર ન મળે તો, ખનીજ વિભાગના અધિકારી તુરંત જ આ બાબત નિયામકશ્રીના ધ્યાન ઉપર મુકશે. જેઓ આ અંગે ઉઘોગ, ખાણ અને ઉર્જા વિભાગ તથા જે તે સંબંધિત વિભાગના સચિવશ્રીના ધ્યાન ઉપર મુકશે અને આવો પત્ર મળ્યેથી સંબંધિત વિભાગના સચિવશ્રી, જે તે કાર્યપાલક ઈજનેરશ્રીને તાત્કાલિક માહિતી પુરી પાડવા સુચના આપશે. આ પ્રમા અમલી બનતા આ પરિપત્રની તારીખથી સીક્યોરીટી ડીપોઝીટ પરત કરવા માટે રોયલ્ટી ભર્યા અંગેના પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.

રાજ્ય સરકારના બાંધકામ માટે વપરાતા ગૌણ ખનિજની રોયલ્ટી ભરવા બાબત....

(૪) આ કામમાં જ્યારે સાદી માટી (ઓર્ડીનરી ક્લે) અને (સોફ્ટ) મુરમ વાપરવામાં આવે તેના ઉપર પણ રોયલ્ટી ચૂકવવાપાત્ર છે. (૫) વિશેષમાં ગૌણ ખનીજ બાબતમાં ગુ.નો.ખ.વિ. ૧૯૬૬ અને તેના અનુસંધાનમાં વખતોવખત બહાર પાડવામાં આવેલા ઠરાવો, લાગુ પડશે, અને સંમુજબ લીઝ કે પરમીટ લેવાનું અને રોયલ્ટી ભરવાની રહેશે. (ઉઘોગ, ખાણ અને ઉર્જા વિભાગ ઠરાવ ક્રમાંક: એમ.એમ.આર. /૧૧૨૦૦૦/૨૦૧૩/૭ તા. ૧-૯-૦૪ "કામ પૂરું થયે કાઈનલ બીલ બન્યે તેની નકલ જિલ્લા ભુસ્તર શાસ્ત્રીને મોકલી રોયલ્ટી પેટે જો રકમ વસૂલ કરવાની બાકી હોય તો કેટલી રકમ વસૂલ કરવાની છે તે જણાવવા પત્ર લખવો. આ પત્ર ભુસ્તર શાસ્ત્રીને મળ્યા બાદ ૪૫ દિવસમાં કોઈ પ્રત્યુત્તર ન મળે તો રોયલ્ટી પેટે કોઈ રકમ વસૂલ કરવાની નથી તેમ માની કાઈનલ બીલ ચૂકવી દેવાનું રહે છે." વિશેષમાં ઈજારદારશ્રી દ્વારા રોયલ્ટી ભર્યા અંગેના રજુ કરેલ દસ્તાવેજો અપૂરતા હોય તો કામમાં વપરાયેલ ગૌણ ખનિજની રોયલ્ટી ભરવાની બાકી હશે તો તે ભરપાઈ કરવા ઈજારદારશ્રી બંધાય છે તેવી બાંહેધરી ઈજારદાર પાસેથી મેળવી સીક્યોરીટી ડીપોઝીટ પરત કરવાની કાર્યવાહી કરવાની રહેશે. (મા.મ. વિ.ના પરિપત્ર ક્રમાંક ટીએનસી/૧૦-૨૦૦૨/(૧૪) સતારીખ ૨૮-૮-૨૦૦૩ તથા ૨૭-૪-૨૦૦૫. અને મા.મ.વિ. પરિપત્ર ક્રમાંક: ટીએનસી-૧૦-૨૦૧૩-(૪)-સી તા. ૮-૮-૨૦૧૪, તા. ૨૦-૭-૨૦૧૬ અને તા.૪-૧૧-૨૦૧૫નો મા.મ.વિ. પરિપત્ર ક્રમાંક: ૫૨૫-૧૦-૨૦૧૫-૫૫-સી)

Signature of the contractor :

કંટ્રાક્ટરની સહી :

Signature of the Executive Engineer :

કાર્યપાલક ઈજનેરની સહી :

Clause 36 Compensation under the workmen's compensation Act : The contractor shall be responsible for and shall pay compensation to his workman payable under the Workmen's Compensation Act, 1923 (VIII of 1923) hereinafter called the said Act) for injuries caused to the workmen. If such compensation is paid by Government as principal under sub-section 12 (1) of the said Act on behalf of the Contractor it shall be recoverable by Government from the contractor under sub-section 12 (2) of the said section. Such compensation shall be recovered in the manner laid down in clause 1 above.

ખંડ ૩૬ કામદાર વળતર અધિનિયમ હેઠળ વળતર : કામદારોને થયેલ ઈજાઓ માટે ૧૯૨૩ના કામદાર વળતર અધિનિયમ (૧૯૨૩ના આક્રમ) (હવે પછી જેને ઉક્ત અધિનિયમ કહી છે તે) હેઠળ ચૂકવવાપાત્ર કોઈ પણ વળતર ચૂકવવા કંટ્રાક્ટર જવાબદાર રહેશે. ઉક્ત અધિનિયમની કલમ ૧૨ની પેટા કલમ (૧) હેઠળ, કંટ્રાક્ટર વતી સરકારે મુખ્ય પસંદગી તરીકે આવું વળતર ચૂકવ્યું હોય તો સરકાર તે રકમ ઉક્ત કલમની પેટા-કલમ (૨) અન્વયે કંટ્રાક્ટર પાસેથી વસૂલ કરી શકશે. આવું વળતર ઉપરના ખંડ ૧ માં જણાવેલી રીતે વસૂલ કરવામાં આવશે.

Clause 36-A The contractor shall be responsible for and shall pay the expenses of providing medical aid to any workmen who may suffer a bodily injury as a result of an accident. If such expenses are incurred by Government, the same shall be recoverable from the contractor forthwith and be deducted, without prejudice to any other remedy of Government from amount due or that may become due to the Contractor.

ખંડ-૩૬-ક અકસ્માતને પરિણામે કોઈ કામદારને શારીરિક ઈજા થાય તો તેને તબીબી સહાય પૂરી પાડવા માટે કંટ્રાક્ટર જવાબદાર રહેશે અને તે અંગેનું ખર્ચ તેમણે ચૂકવવાનું રહેશે. આવું ખર્ચ સરકારે કર્યું હોય તો કંટ્રાક્ટર પાસેથી તે તરત જ વસૂલ કરવા પાત્ર રહેશે અને સરકારના બીજા કોઈ પગલાને બાધ ન આવે એ રીતે કંટ્રાક્ટરની લેણી અથવા હવે પછી લેણી થનાર રકમમાંથી તે કાપી લેવાશે.

Clause 36-B The contractor shall provide all necessary personal safety equipment and first aid apparatus available for the use of the person employed on the site and shall maintain the same in suitable condition for immediate use at any time and shall comply with the following regulations in connection therewith :

(a) The workers shall be required to use the equipment so provide by the Contractor and Contractor shall take adequate steps to ensure proper use of the equipment by those concerned.

(b) When work is carried on in proximity to any place where there is a risk of drowning all necessary equipment shall be provided and kept for use and all necessary steps shall be taken for the prompt rescue of any person, in danger.

(c) Adequate provision shall be made for prompt first aid treatment of all injuries to be sustained during the course of the work.

Clause 37 The quantities shown in the tender are approximate and no claim shall be entertained for quantities of work executed being less than those entered in the tender. In the case of increase in the quantities by more than 10% the new rate will be paid to the contractor for the quantities in excess of 10%. The rates for the increased quantities as aforesaid will be fixed in the manner specified in clause - 14.

(Corrected as per R & B G.R. No. TNC-10-2017-01-C, Dated 11-7-2017)

CLAUSE 38 Employment of famine or other labour : The contractor shall employ any famine, convict or other labour or particular kind or class, if ordered in writing to do so by the Engineer-in-charge.

ખંડ-૩૮ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના અથવા બીજા મજૂરોને કામે રાખવા બાબત : હવાલાના ઈજનેર એવો લેખિત હુકમ કરે તો દુષ્કાળથી અસરગ્રસ્ત, ગુનેગાર તરીકે સજા પામેલા અથવા અમુક ચોક્કસ પ્રકારના કે વર્ગના બીજા મજૂરોને કંટ્રાક્ટરે કામે રાખવાના રહેશે.

CLAUSE 39 No compensation shall be allowed for any delay caused in the starting of the work on account of delay in making available the full site of land at a time.

CLAUSE 40 No claim for compensation shall be allowed for any delay in execution of the work on account of water standing in borrow pits or compartment. The rates are inclusive of hard or cracked soil, excavation in mud, sub soil water or water standing in borrow-pits and no claim for an extra rate shall be entertained unless otherwise expressly specified.

ખંડ-૪૦ કામ કરવામાં થયેલ વિલંબ માટે વળતર અંગેનો હક્ક દાવો : ચોકડીમાં અથવા કોઈ ભાગમાં પાણી જવાને કારણે કામ કરવામાં વિલંબ અંગે કશું વળતર અપાશે નહિ. આ દરમાં સખત અથવા તિરાડવાળી જમીન માટેના કાદવ અને ભૂચર્મ જળવાળા ભાગમાં પાણી ભરાઈ રહેતું હોય તેવી ચોકડીની જગ્યામાં ખોદકામ માટેના દરનો સમાવેશ થાય છે અને તેથી અન્યથા સ્પષ્ટ જણાવ્યું હોય તે સિવાય, વકારાના દર માટે કોઈ હક દાવો ધ્યાનમાં લેવાશે નહિ.

CLAUSE 41 Entering upon or commencing any portion or work : The Contractor shall not enter upon or commence any portion or work except with the written authority and instruction of the Engineer-in-charge or of his subordinate in charge of the work. Failing such authority, the Contractor shall have no claim to ask measurement of or payment for work.

ખંડ-૪૧ કામની કોઈ ભાગ નવેસરથી હાથ કરવા કે શરૂ કરવા બાબત : હવાલાના ઈજનેરને અથવા તાબાના કામના હવાલાના અધિકારીનો લિખિત હુકમ અને સૂચના સિવાય કંટ્રાક્ટ કામની ભાગ નવેસરથી હાથ કરી કે શરૂ કરી શકશે નહિ, આવો હુકમ ન મળ્યો હોય તો કામના કોઈ માપ લેવા અંગે કે ચુકવણી માટે કંટ્રાક્ટર કશો હક્કદાવો કરી શકશે નહિ.

CLAUSE 42 Minimum age of person employed : (i) No Contractor shall employ any person who is under the age of 15 years.

Signature of the contractor :

કંટ્રાક્ટરની સહી :

Signature of the Executive Engineer :

કાર્યપાલક ઈજનેરની સહી :

નંદ-૪૨ કામે રાખેલ વ્યક્તિઓની ઓછામાં ઓછી વય : કંટ્રાક્ટર ૧૫ વર્ષની નીચેની ઉંમરની કોઈ પણ વ્યક્તિ કામે રાખી શકશે નહિ.

CLAUSE 42 (i) (A) The employment of donkeys and / or other animals and the payment of fair wages : For Asphalt works as far as possible, only the adult persons should be employed by the contractor. If the adult persons are not available, then the children below the age of 15 (Fifteen years) should not be employed under any circumstance.

(ii) No contractor shall employ donkeys or other animals with breaching of string or thin rope. The breaching must be at least three inches wide and should be of tape. (Nawar).

(૨) કંટ્રાક્ટર એકા અથવા બીજા પ્રાણીઓના પીઠના ભાગ પર ઝીંઝી દોરી અથવા પાતળું દોરું બાંધીને તેમને કામે લઈ શકશે નહિ. પીઠ ભાગ પર બાંધેલા ઓછામાં ઓછી ૩ ઇંચ પહોળી કીત (નવાર) કામમાં લેવી.

(iii) No animal suffering from sores, lameness or emaciation or which is immature shall be employed on the work.

(૩) કારાવાળાં, ખોડાવાળાં અથવા કૃષ્ણ કે નાના પ્રાણીને કામે રાખી શકાશે નહિ.

(iv) The Engineer-in-charge or his agent is authorised to remove from the work any person or animal found working which does not satisfy these conditions and no responsibility shall be accepted by Government for any delay caused in the completion work by such removal.

(૪) આ શરતો મુજબ ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી કામ કરતી/કરતું માલૂમ પડે તો તેને કામ પરથી દૂર કરવાની સત્તા હવાલાના ઇજનેરને કે તેમના એજન્ટને છે અને આવી રીતે કોઈ વ્યક્તિ કે પ્રાણીને દૂર કરવાથી થયેલ કોઈ પણ વિલંબ માટે સરકારની કોઈ જવાબદારી રહેશે નહિ.

(v) The contractor shall pay fair and reasonable wages to the workman employed by him in the contract undertaken by him. In the event of any dispute arising between the Contractor and his workmen on the grounds that the wages paid are not fair and reasonable, the dispute shall be referred without delay to the Engineer-in-charge who shall decide the same. The decision of the Engineer-in-charge shall be conclusive and binding on the Contractor, but such decision shall not in any way affect the conditions in the contract regarding the payment to be made by Government at the sanctioned tender rates.

(૫) પોતે હાથ ધરેલા કંટ્રાક્ટ માટે કામે રાખેલ કામદારોને કંટ્રાક્ટરે વાજબી વેતન ચૂકવવાનું રહેશે. ચૂકવેલ વાજબી ન હોવાના પુરાવા પર કંટ્રાક્ટર અને તેમના કામદારો વચ્ચે કોઈ અડકો ઉભો થાય તો એ અડકો વિના વિલંબે હવાલાના ઇજનેરને સોંપવામાં આવશે અને તે અંગે તેઓ નિર્ણય આપશે. હવાલાના ઇજનેરનો નિર્ણય કંટ્રાક્ટર માટે નિર્ણાયક અને બંધનકર્તા રહેશે. પરંતુ આ નિર્ણયથી મંજૂર કરેલા ટેન્ડરના દરે સરકારે કરવાની થતી ચૂકવણીને લગતી કંટ્રાક્ટમાંની શરતોને કશી અસર થશે નહિ.

(vi) The contractor shall provide drinking water facilities to the workers / labourers employed on Government works. Amenities relating to sanitation shall also be provided to the workers/labourers employed on works (in urban areas). If the contractor fails to comply with these provisions, the Engineer-in-charge shall give notice in writing and if the contractor does not provide this facility to the workers/labourers within a period of ten days from the date of the notice in writing, the Engineer-in-charge shall thereupon make the arrangement for drinking water at the cost of the contractor.

(૬) સરકારી કામે રાખેલા કામદારો - મજૂરોને પીવાના પાણીની સગવડ કંટ્રાક્ટરે પૂરી પાડવાની રહેશે. (શહેરી વિસ્તારોમાં) કામે રાખેલા કામદારોને સ્વચ્છતા વિષયક સગવડો પણ પૂરી પાડવાની રહેશે. કંટ્રાક્ટર આ જોગવાઈનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો હવાલાના ઇજનેર તેને લેખિત નોટિસ આપશે અને કંટ્રાક્ટર આવી લેખિત નોટીસની તારીખથી દિન દસની મુદતમાં કામદારો - મજૂરોને આ સગવડ નહિ આપે તો હવાલાના ઇજનેર કંટ્રાક્ટરના અર્થે પીવાના પાણીની વ્યવસ્થા કરશે.

(vii) The contractor shall provide the amenity of proper shade and shelter to the workers/labourers and their children on Government works as soon as the work starts. If the contractor fails to provide shed and shelter, the Engineer-in-charge shall provide the same at the cost of contractor.

(૭) કામ શરૂ થાય કે તરત જ કંટ્રાક્ટરે સરકારી કામ પરના કામદારો - મજૂરો અને તેમના બાળકોને યોગ્ય શેડ અને આશ્રય આપવાની સગવડ પૂરી પાડવાની રહેશે. શેડ અને આશ્રયસ્થાન પૂરા પાડવામાં કંટ્રાક્ટર નિષ્ફળ જશે તો કંટ્રાક્ટરના અર્થે હવાલાના ઇજનેર પૂરા પાડશે.

CLAUSE 43 Method of payment : Payment to contractor shall be made by cheque drawn on any treasury within the division convenient to them, provided the amount exceeds Rs. 10 Amount not exceeding Rs. 10 will be paid in cash.

નંદ-૪૩ ચૂકવણીની રીત : ચૂકવણીની રકમ રૂ. ૧૦ કરતાં વધુ હોય તો, કંટ્રાક્ટરને અનુકૂળ હોય તેવી ડિવિઝનના વિસ્તારની કોઈપણ સિબેરી પરના ચેક દ્વારા તેમને ચૂકવણી કરાશે. રૂ. ૧૦ થી વધુ ન હોય તેવી રકમ રોકડેથી ચૂકવવામાં આવશે.

CLAUSE 43-A Any sum of money due and payable to the Contractor (including the security deposit returnable to the contractor) executing any Government work or work of any District Panchayat wholly financed as grant-in-aid under this contract shall be appropriated by any District Panchayat / Government and shall be set off against any claim of the Government/District Panchayat of Gujarat state by the District Panchayat of Gujarat State/Government for the payment of a sum of money arising out or under any other contract made by the contractor with the Government/District Panchayat of Gujarat State for the work wholly financed as grant-in-aid by Government of Gujarat State. When no such amount for

Signature of the contractor :

કંટ્રાક્ટરની સહી :

Signature of the Executive Engineer :

કાર્યપાલક ઇજનેરની સહી :